

NSL/CS/2022/39 Date: August 10, 2022

To, The Department of Corporate Services **BSE Limited** Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai- 400 001 To, The Listing Department **National Stock Exchange of India Limited** Exchange Plaza, C/1, Block G Bandra-Kurla Complex, Bandra (E), Mumbai - 400 051

Scrip Code: 542231

Scrip Symbol: NILASPACES

Dear Sir,

<u>Reg: Submission of Newspaper Advertisement published for Notice of 22nd Annual General</u> <u>Meeting, Book Closure, Remote E-voting and Other Information</u>

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of Companies (Management and Administration) Rules, 2014 (as amended), we are hereby submitting copy of newspaper advertisement published in the Business Standard-English and Loksatta Jansatta - Gujarati edition regarding Remote E-Voting Information and Notice of 22nd Annual General Meeting to be held through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM) facility on Wednesday, August 31, 2022.

Kindly take the same on your record and acknowledge the receipt.

Thanking you, Yours faithfully, For, Nila Spaces Limited Gopi Dave Company Secretary

Encl: a/a

Aadhar Housing Finance Ltd. Corporate Office: Unit No. 802, Natraj Rustomjee, Western Express Highway and M.V. Road, Andheri (East), Mumbai - 400069.

	Aadha]
n r	Housing Finance I	.1

. .

Vapi Branch : Girnar Khushboo Plaza, Commercial Plot-209, Opp Vishal Mega Mart, GIDC, Vapi-396195, (Gujarat)

APPENDIX IV POSSESSION NOTICE (for immovable property)

Whereas, the undersigned being the Authorized Officer of Aadhar Housing Finance Limited (AHFL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Sub-Section (4) of the Section 13 of the said Act read with Rule 8 of the Security Interest Enforcement rules, 2002. The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of AHFL for an amount as mentioned herein under with interest thereon.

Sz. No.	Name of the Borrower(s)/ Co Borrower(s) (Name of the Branch)	Description of Secured Asset (Immovable Property)	Demand Notice Date & Amount	Date of Possession
1	(App No. 00075075/ Vapi Branch) Poojadevi Rameshkumar Keshri (Borrower), Ramesh Premchand Kesari (Co-Borrower)	All that part & parcel of property bearing, Flat No. 206, 2nd Floor, Gayatri Darsan, Vallabh Nagar, Coprali Road, Chhiri, Sub. Dist. Vapi, Dist. Valsad, Vapi (Micro Branch), Valsad, Gujarat-396195. Boundaries : East : Open Space, West : Passage, North : Flat No. 205, South : Life & Flat No. 201.	15-04-2021 & ₹ 9,38,077/-	06-08-2022
	ace : Vapl Valsad ate : 10.08.2022	Aadha	Authorised O Ir Housing Fin	

eClerx eClerx Services Limited CIN : L72200MH2000PLC125319 Regd. Office: Sonawala Building, 1 st Floor, 29, Bank Street, Fort, Mumbai - 400 023								
Regd. Office: Sonawala Building, 1 st Floo Phone: +91 (22) 6614 8301 Fax: +91 (22) 6614 8655	or, 29, Bank Str Email : investe	eet, Fort, Mumi pr@eclerx.com	pai - 400 023 Website: ww	w.eclerx.com				
	EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS							
FOR THE QUARTER ENDED JUNE 30, 2022 (Rupees In million, except per share data)								
Quarter ended Year ended								
Particulars	June 30, 2022	March 31, 2022	June 30, 2021	March 31, 2022				
	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)				
Total income from operations	6,178.35	5,916.65	4,862.60	21,603.45				
Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	1,354.73	1,587.22	1,215.35	5,604.87				
Net Profit for the period before tax (after Exceptional and/or Extraordinary items)	1,354.73	1,587.22	1,215.35	5,604.87				
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	995.14	1,184.00	920.36	4,177.58				
Total Comprehensive Income for the period [Comprising Profit for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	825.48	1,174.82	969.92	4,207.35				
Paid up equity share capital (Face value of Rs. 10 each, fully paid up)	331.11	330.98	341.31	330.98				
Reserves (excluding Revaluation Reserve) as shown in Audited Balance Sheet of the previous year				15,357.18				
Earnings per share (EPS) (for continuing and discontinued operations) (of Rs. 10 each) (Not annualised) Basic	29.97	35.87	26.84	123.81				
Diluted	29.44	35.16	26.55	123.57				
Extract of Unaudited Standalone Financial Result				121.01				
		Quarter ended	,	Year ended				
Particulars	June 30, 2022	March 31, 2022	June 30, 2021	March 31, 2022				
Faruçularə	(Unaudited)	(Audited)	(Unaudited)	(Audited)				
Total income from operations	4,347.16	4,280.76	3,437.13	15,513.12				
Profit before tax	968.57	1,273.27	1,102.80	4,768.18				
Profit after tax	720.22	954.61	821.18	3,548.96				
 Note: The above is an extract of the detailed format of the unaudited Consolidated Financial Results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the audited financial results are available on the Stock Exchanges websites, www.bseindia.com and www.nseindia.com and on the Company's website www.eclerx.com. 								
Place : Mumbai Date : August 09, 2022				Sd/- PD Mundhra tive Director				



Registered Office: 1st Floor, Sambhaav House, Opp. Chief Justice's Bunglow, Bodakdey, Ahmedabad - 380 015.

Г	JINDAL HOTELS LIMITED							
	(CIN No.: L18119GJ1984PLC006922)							
	Registered Office : Grand Mercure Vadodara Surya Pala	ice, Sayajigunj, Vad	odara - 390 020.					
	Tel : 0265 - 2363366 Fax : 0265 - 2363388 Email : share@surya			æ.com				
S	TATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS F	OR THE QUA	RTER ENDED	30.06.2022				
				(₹ in Lacs)				
Г		For the Quarter	For the Quarter	For the Year				
	Particulars	ended	ended	ended				
		30.06.2022	30.06.2021	31.03.2022				
1	Revenue from operations	1,029.69	363.90	3,039.24				
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and / or Extraordinary items)	1.71	(236.86)	(308.89)				
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and / or Extraordinary items)	1.71	(236.86)	(308.89)				
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and / or Extraordinary items)	0.71	(241.77)	(240.29)				
5	Total Comprehensive Income for the period [comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.00	2.20	0.01				
6	Equity Share Capital	700.00	665.00	700.00				
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the	-	-	978.97				
	previous year Eamings per share (of ₹ 10/- each) Basic & Diluted (Rs.)	0.01	(3.64)	(3.61)				
•								
	otes : 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results							
	SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The			is available on the				
	Company's Website at www.suryapalace.com and the BSE Website (URL of Fillings) www.bseindia.com.							
	The above unaudited results have been reviewed by the Audit Committee and apprendiction of the second seco	proved by Board of Dire	ctors in their meeting he	ld on 09.08.2022.				
			For JINDAL	HOTELS LIMITED				
D	ate : 09th August, 2022			Piyush D. Shah				
	ace : Vadodara		N	lanaging Director				

	DFC First Bank Limited								
	Formerly known as Capital First Home Finance Limited/ Capital First Limited) IN : L65110TN2014PLC097792 Bank								
				Road, Chetpet, Chennai- 600031.				Dallik	
Tel :	+91 44 4564 400	00 Fax: +91 44 4564 4							
				<u>K- IV-A [See proviso</u>					
		<u>SALE NU</u>	IIICE I	OR SALE OF IMMOV	/ABLE	PROP	EKTLES		
				under the Securitisation and Rec Security Interest (Enforcement) R			cial Assets an	d Enforcem	ent of Secur
				particular to the Borrower (s) and			per column (i	i) that the be	elow describ
				I/charged to the Secured Credito					
				nance Limited and Capital First L					
Co-l	Borrower (s) as p	per column (i), due to IE	OFC FIRST	14th Sep 2022 as described here Bank Limited (erstwhile Capital Fi afer to the link provided in IDFC FI	rst Home F	inance Li	mited and Cap	ital First Lim	ited).
		(ii)	io, piozoo ii I	(iii)	(iv)	(v)	(vi)		 (vii)
S. No	(i) Demand Notice Date	Name Borrower (s) and		("") PROPERTY ADDRESS	Reserve Price	EMD Amount	Date and	Name a	ind Mobile
	and Amount	Co-Borrower (s)			Amount		EMD Auction	-	zed officer
1	INR 8.13.063.78/-	Sanjay Rabari & Ankitaben Rabari		. D. 205, on Second Floor, having asuring 54 Sq. Yds. (Super Built Up)			14th Sep 2022		sh Mukherje
	Demand Notice:	Anknaden Kadan		undivided share in land of the		07,400/-	2022 11.00 TO	2) MR. Deb	
	17th Apr 2021		Scheme kn	own as Umang Lambha-1, Lambha			1.00 PM		74702021
	-		Aslali Road	, Ahmedabad, Gujarat - 382445					
		ny, present at the immo		d for sale of immovable property erty.	oniy and n				s
mov							I	Auth DFC FIRST	S Sorized Offic Bank Limit
mov Date	able assets, if an a: 10.08.2022 DFC Fii	ny, present at the immo	Divable prop	(Formerly known as i			I	Auth DFC FIRST ted/ Capital	S Norized Offic Bank Limit First Limite
Date	able assets, if an a: 10.08.2022 FC Fil merty known as : L65110TN2014 istered Office: -	ny, present at the immo TST Bank Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor	Limi Inance Lim	erty. (Formerty known as	Capital Fin		I	Auth DFC FIRST ted/ Capital	S orized Offic Bank Limit First Limite
Date	able assets, if an a: 10.08.2022 FC Fil merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400	ny, present at the immo rst Bank s Capital First Home F BPLC097792 KRM Towers, 7th Floo 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co	Limi Inance Lim r, Harringtor 1022 Dontact Num	(Formerly known as (Formerly known as ted/Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of	Capital Fin	st Home	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S Bank Limit First Limite
Date	able assets, if an a: 10.08.2022 FC Fil merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400	ny, present at the immo TST Bank Capital First Home F PIC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co APPE	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num	(Formerly known as (Formerly known as ted/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031.	Capital Fin ficer – Deb	st Home	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S Bank Limit First Limite
Date Date (For CIN Reg Tel : Auth	able assets, if an a: 10.08.2022 FC Fill merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400 horlzed Officer -	ny, present at the immo TST Bank Capital First Home F PLC097792 KRM Towers, 7th Floor 00 Fax: 491 44 4564 4 - Divyarajsinh Zala Co APPE SALE NOT e for Sale of Immovable	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num E. 101X T 101 E for Assets under	(Formerly known as i ted Ited/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of -A [See proviso to rule 8 (C SALE OF IMMOV/ABLE PROF er the Securitisation and Reconstruct	Capital Fin ficer – Deb 5)] 23)1125	st Home jyoti Roy	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S iorized Offi Bank Limit First Limit First Limit
Date	able assets, if an able assets, if able assets, if able assets, if an able assets, if able asset	ny, present at the immo rst Bank S Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 - Divyarajsinh Zala Co <u>APP</u> <u>SALE NOT</u> a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num ENDIXEN ICE COR Assets undr	(Formerly known as i ted Ited/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of /A [See proviso to rule 8 ((SALE OF IMMOVABLE PRO) or the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002	Capital Fin ficer – Deb 3)] 23:11133 23:11133 24:11133	st Home jyoti Roy ncial Asse	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S Bank Limit First Limit First Limit FIRST CFIRST X D2021
Date Date (Fon CIN Reg Tel : Auth E-Auth E-Auth Date Date	able assets, if an a 10.08.2022 FC Fin merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400 horized Officer - 2 read with provise ce is hereby giver erties as per colu	ny, present at the immo rest Bank Scapital First Home F PLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +01 44 4564 4 - Divyarajsinh Zala Co <u>APP2</u> <u>SALE N(1)</u> a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec n to the public in general rmn (iii) mortgaged/charg	Limi Inance Lim , Harringtor 1022 ontact Num E. 101X- IV (IC) = FOR Assets under surity Interess and to the St	(Formerly known as i ted/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A [See proviso to rule 8 (C SALE OF IMMOVABLE PROF ar the Securitisation and Reconstruct t(Enforcement) Rules, 2002 cular to the Borrower (s) acnd Co-Bo secured Creditor, the physical posses	Capital Fin ficer – Deb)) Clinitian clion of Fina prower (s) ison of which	st Home jyoti Roy ncial Asse as per colu h has beer	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S orized Offifi Bank Limit First Limit First Limit C FIRST C FIRST C FIRST C FIRST C FIRST C FIRST C FIRST C FIRST
Date Date (Fon CIN Reg Tel : Auth E-Au 2002 Notic prop Capi	able assets, if an able assets, if able assets, if an able assets, if able assets, i	ny, present at the immo rest Bank Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 - Divyarajsinh Zala Co <u>APP</u> <u>SALE NOT</u> a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec n to the public in general mn (iii) mortgaged/char nance Limited and Capit	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num ENDIXE I (ICEEC)R Assets undrees I and in parti ged to the Stat I First Limi	(Formerly known as i ted/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A [See proviso to rule 8 (SALE OF IMMOVABLE PROF or the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) acnd Co-Bo scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, v	Capital Fin ficer – Deb j) 21:11133 dion of Fina mrower (s) sion of while sold of fina	st Home jyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S oorized Offi Bank Limit First Limit First Limit First Limit Council
Date Date (Fon CIN Reg Tel : Autt E-Au 2002 Notic prop Capi is" a	able assets, if an able a	ny, present at the immo rest Bank Capital First Home F PLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 - Divyarajsinh Zala CO 00 Fax: +91 44 4564 - Divyarajsinh Zala CO - Divyarajsinh Zala CO	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num ENDIXE IV ICE E COR Assets undr surity Interess and in parti ged to the So tal First Limi ged to the So tal First Limi y of amou	(Formerly known as i ted) Ited/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A See proviso to rule 8 (SALEOF IMMOVABLE PRO ar the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) acnd Co-Bo scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, w t due from Borrower (s) and Co-B	Capital Fin ficer – Deb j) 21:11133 dion of Fina mrower (s) sion of while sold of fina	st Home jyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi	Finance Limit	Auth DFC FIRST ted/ Capital	S oorized Offi Bank Limit First Limit First Limit First Limit Council
Date	able assets, if an able assets, if able assets, if an able assets, if able assets, i	ny, present at the immo rest Bank Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co <u>APP</u> <u>SALE N(OT</u> a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec in to the public in general mn (iii) mortgaged/char mance Limited and Capit reunder, for the recover at Home Finance Limited	Limi Inance Lim r, Harringtor 1022 ontact Num E(D)/CIV (IC = COR Assets under Unity Interes I and in parti get to the St and in parti and in parti and in parti and an parti and an parti and capital	(Formerly known as i tect) ited/ Capital First Limited) ited/ Capital First Limited) i Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A [See proviso to rule 8 (C SALE OF II.M. OV/ABLE PTO) or the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) acnd Co-Bc scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, v it due from Borrower (s) and Co-B First Limited).	Capital Fin ficer – Deb Oligo Oligo Capital Fin Sign of Fina Sion of whice sion of whice vill be sold corrower (s) orrower (s)	st Home jyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi as per co	Finance Limit	Auth DFC FIRST ted/ Capital IDFC Bank ber- 987470 ment of Secu below descri uthorised Off what is", and " b DFC FIRS	S oorized Offie Bank Limit First Limit First Limit CEIRST 02021
Date	able assets, if an assets, if an assets, if an asset as a set as a series as a constrained officer - as a series a	ny, present at the immo rest Bank Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co <u>APP</u> <u>SALE N(OT</u> a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec in to the public in general mn (iii) mortgaged/char mance Limited and Capit reunder, for the recover at Home Finance Limited	Limi Inance Lim r, Harringtor 1022 ontact Num E(D)/CIV (IC = COR Assets under Unity Interes I and in parti get to the St and in parti and in parti and in parti and an parti and an parti and capital	(Formerly known as i ted) Ited/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A See proviso to rule 8 (SALE OF IMMOVABLE PRO ar the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) and Co-Bo scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, w t due from Borrower (s) and Co-B First Limited). to the link provided in IDFC FIRST B	Capital Fin ficer – Deb Oligo Oligo Capital Fin Sign of Fina Sion of whice sion of whice vill be sold corrower (s) orrower (s)	iyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi as per co i.e. <u>www.</u>	Finance Limit	Auth DFC FIRST ted/ Capital IDFC Bank ber- 987470 ment of Secu below descri uthorised Off what is", and " b DFC FIRS	S oorized Offie Bank Limit First Limit First Limit CEIRST 02021
Date Date (For CIN Reg Tel : Auth E-Au 2002 Notic prop Capi is" a (erst For c S.	able assets, if an able assets, if able assets, if an able assets, if able assets, if an able assets, i	ny, present at the immo rest Bank Capital First Home F PLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co 25 ALE LOIT a for Sale of Immovable oto Rule 8 (6) of the Sec n to the public in general mn (iii) mortgaged/cham nance Limited and Capir reunder, for the recover at Home Finance Limited d conditions of the sale, j (ii) Name Borrowe	Limi Inance Lim r, Harringtor 1022 ontact Num I (I) I (I) (I) Assets undr III) (I) (I) I III) (I) I III) (I) I III) (I) I III) I III) (I) I III) I III) I III) I III I III) I III I III) I III I I I III I IIII I III I IIII I III I IIII I III I III I IIII I III I IIII I IIII I IIII I IIII I III I IIII I III I IIII I IIIII I IIIII I IIII I IIII I IIIII I IIII I IIII I IIII I IIII I IIIII I IIIII I IIII I IIIII I IIIII I IIIII I IIIII I IIIIII	(Formerly known as i ted/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A [See proviso to rule 8 (SALE OF IMMOVABLE PROF ar the Securitisation and Reconstruct (Enforcement) Rules. 2002 cular to the Borrower (s) and Co-B scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, v t due from Borrower (s) and Co-B First Limited). to the link provided in IDFC FIRST Bank (iii)	Capital Fin ficer – Deb ()) () () () () () () () () () () () ()	st Home jyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi as per co i.e. <u>www.</u> (iv) Reserve	Finance Limit	Auth DFC FIRST ted/ Capital DFC Bank ber- 98747(ment of Secu below descri uthorised Off what is", and " o DFC FIRS com. (vi) Date and	S oorized Offic Bank Limit First Limite C FIRST 202021 rity Interest A ibed immova ficer of erstwi Whatever the T Bank Limit (vii) Date and
Date Date (Fon CIN Regi Tel : Auth E-Au 2002 Notic prop Capi is" a (erst For C	able assets, if an a 10.08.2022 FC File merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400 horized Officer - 2 read with provise ce is hereby giver erties as per colu tal First Home File as described her while Capital First detailed terms and (i) Demand Notice Date	ny, present at the immo rest Bank Capital First Home F PLC097792 KRM Towers, 7th Floor DO Fax: 41 44 4564 - Divyarajsinh Zala Co PLC097792 SALE NOT a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec h to the public in general mn (ii) mortgaged/charn nance Limited and Capit reunder, for the recover t Home Finance Limited d conditions of the sale, I Name Borrower and	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num E. IDIXE IV ICE E for Assets under unity Interess and in parti ged to the Sc and in parti ged to the Sc and in parti ged to the Sc and La First Limi ery of amound and Capital please refer r (s)	(Formerly known as i ted) Ited/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A See proviso to rule 8 (SALE OF IMMOVABLE PRO ar the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) and Co-Bo scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, w t due from Borrower (s) and Co-B First Limited). to the link provided in IDFC FIRST B	Capital Fin ficer – Deb ()) Efficil = 5 dion of Fina sion of whic sion of whic vill be sold d orrower (s) ank website	iyoti Roy ncial Asse as per colu h has beer n *A is wi as per co i.e. <u>www.</u> (iv) Reserve Price	Contact Num ts and Enforcer umn (ii) that the n taken by the A nere is", "As is w lumn (), due to idicfirstbank.co	Auth DFC FIRST ted/ Capital DFC FIRST Bank ber- 98747(ment of Secu uthorised Off uthorised off that is', and below descri uthorised off that is', and DFC FIRS com. (vi) Date and Time of	S orized Offi Bank Limit First Limit First Limit First Limit First Limit C FIRST C FIR
Date Date (Fon (Fon CIN Regg Tel : Auth E-Au2 2002 Notic prop CCapi is" a (erst For C	able assets, if an a 10.08.2022 FC Fill merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400 horized Officer - 2 read with provise c is hereby giver erties as per colling as described her while Capital Firs detailed terms and Notice Date and Amount	ny, present at the immo rest Bank Capital First Home F PLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 - Divyarajsinh Zala Co 20 Fax: +91 44 4564 - Divyarajsinh Zala Co AD2 SALE NOT a for Sale of Immovable o to Rule 8 (6) of the Sec n to the public in general mn (ii) mortgage/charn nance Limited and Capit reunder, for the recove at Home Finance Limited d conditions of the sale, I Name Borrower and Co-Borrower	Limi Inance Lim r, Harringtor 1022 Intact Num ENDIXE IV ICE E COR Assets undress and in parti ged to the Sc tal First Limi ged to the Sc tal First Limit	(Formerly known as i ted) (Formerly known as i ted) Capital First Limited) (Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A See proviso to rule 8 (SALE OF IMMOVABLE PRO ar the Securitisation and Reconstruct (Enforcement) Rules, 2002 cular to the Borrower (s) and Co-B scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, w the due from Borrower (s) and Co-B First Limited). to the link provided in IDFC FIRST Bi (iii) PROPERTY ADDRESS	Capital Fin ficer – Deb (1) 21:1113) dion of Fina prower (s) sion of Milc vill be sold co orrower (s) ank website	iyoti Roy ncial Asse as per colu h has beer n "As is with as per co i.e. <u>www.</u> (iv) Reserve Price Amount	Finance Limit	Auth DFC FIRST ted/ Capital DIDFC Banh ber- 987470 ment of Secu uthorised Off uthorised Off to DFC FIRS com. (vi) Date and Time of Auction	Servized Offi Bank Limit First Limit First Limit First Limit First Limit First Limit O2021 02020 02020 02020 02020 02020 02020 02020 02020 02020 02020 02020 02020 02020 0200 0200 0200 0000 000000
Date Date (Fon CIN Reg Tel : Autt E-Au2 2002 (erst For c S. NO 1	able assets, if an a 10.08.2022 FC File merty known as : L65110TN2014 istered Office: - +91 44 4564 400 horized Officer - 2 read with provise ce is hereby giver erties as per colu tal First Home File as described her while Capital First detailed terms and Demand Notice Date	ny, present at the immo rest Bank Capital First Home F IPLC097792 KRM Towers, 7th Floor 00 Fax: +91 44 4564 4 - Divyarajsinh Zala Co I (AP2) SALE N(1) a for Sale of Immovable oto Rule 8 (6) of the Seco In to the public in general mn (iii) mortgaged/ncar mn (iii) protgaged/ncar mn (iii) mortgaged/ncar mn (iii) mortgaged/ncar in to the public in general mn (iii) mortgaged/ncar in to the public in general mn (iii) mortgaged/ncar in to the public in general mn (iii) mortgaged/ncar (iii) Name Borrower and Co-Borrower I M/S. Mahesh Hotel	Limi Inance Lim r, Harringtor 1022 ontact Num E.(D)/CI (C) = CO Assets under unity Interes I and in parti ged to the Si and Capital please refer r (s) (s) & Guest	(Formerly known as i ted/ Capital First Limited) Road, Chetpet, Chennai- 600031. ber – 9274207909 Authorized Of A [See proviso to rule 8 (SALE OF IMMOVABLE PROF ar the Securitisation and Reconstruct (Enforcement) Rules. 2002 cular to the Borrower (s) and Co-B scured Creditor, the physical posses ted now IDFC FIRST Bank Limited, v t due from Borrower (s) and Co-B First Limited). to the link provided in IDFC FIRST Bank (iii)	Capital Fin ficer – Deb Di 21:11133 and final prover (s) sion of Final prover (s) ank website Being A	st Home jyoti Roy ncial Asse as per colu h has beer n "As is wi as per co i.e. <u>www.</u> (iv) Reserve Price Price Amount INR	I Finance Limit Contact Num ts and Enforcer umn (ii) that the taken by the Av here is", "As is w lumn (i), due to idfcfirstbank.co (v) EMD Amount	Auth DFC FIRST ted/ Capital DFC FIRST Bank ber- 98747(ment of Secu uthorised Off uthorised off that is', and below descri uthorised off that is', and DFC FIRS com. (vi) Date and Time of	Servized Offi Bank Limit First Limit First Limit First Limit First Limit C FIRST C FIR

Phone: +91 79 4003 6817/ 18 Fax: +91-79-26873922 E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

NOTICE OF 22nd ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INFORMATION AND BOOK CLOSURE

NOTICE IS HEREBY GIVEN THAT THE 22nd ANNUAL GENERAL MEETING ("AGM") OF THE COMPANY WILL BE HELD ON WEDNESDAY, AUGUST 31, 2022 AT 04:00 P.M. THROUGH VIDEO CONFERENCING (VC)/ OTHER AUDIO VISUAL MEANS (OAVM) TO TRANSACT THE BUSINESSES AS SET OUT IN THE NOTICE OF THE AGM.

Dispatch:Notice of the 22nd AGM and Annual Report for the financial year ended on March 31, 2022 have been sent to all the Members whose email addresses are registered with the Company and/or Depositories in accordance with the Circular issued by Ministry of Corporate Affairs Circular No. 20/2020 dated May 05, 2020 read with its circulars No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 39/2020 dated December 31, 2020 and Circular No. 02/2021 dated January 13, 2021(collectively referred to as "MCA Circulars") and SEBI Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and circular no. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021 and clarification dated May 05, 2022 (collectively referred to as "SEBI Circulars"). The dispatch of Notice of AGM has been completed on Tuesday, August 09, 2022.

The Notice of the 22nd AGM and Annual Report for the financial year ended on March 31, 2022 interalia indicating the process and manner of remote e-voting are available at the Company's website at www.nilaispaces.com under investors segment which can be freely downloaded by any member.

Book Closure:Notice is also hereby given that pursuant to provision of Section 91 of the Companies Act, 2013 read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, August 25, 2022 to Wednesday, August 31, 2022 (both days inclusive) for the purpose of 22nd AGM of the Company.

Voting through Electronic Mode: Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, Secretarial Standards - 2 on General Meetings and Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Members of the Company holding shares either in physical or dematerialized form as on the cut-off date i.e. Wednesday, August 24, 2022, are offered the facility of exercising their votes by electronic means through the remote e-voting services provided by National Securities Depository Limited ("NSDL") on any or all businesses to be transacted at the AGM as specified in the notice.

The remote e-voting shall commence on Sunday, August 28, 2022 (09:00 a.m.) and shall end on Tuesday, August 30, 2022 (05:00 p.m.). The remote e-voting shall be disabled by NSDL after the said date and time. Once the votes are casted by the Members on the various resolutions by remote e-voting, he/she will not be allowed to change it subsequently. Those members, who shall be present at the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.

Any person who acquires shares of the Company and becomes a Member after dispatch of the Notice and holding shares as on cut-off date i.e. Wednesday, August 24, 2022, may obtain the login ID and Password by sending a request at evoting@nsdl.co.in or to the Company at secretarial@nilaspaces.com or to the Company's Registrar, M/s. MCS Share Transfer Agent Limited at mcsstaahmd@gmail.com. However, if a person is already registered with NSDL for remote e-voting then existing user ID and Password can be used for casting vote.

The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes agair


Scrutinizer: The Company has appointed Mr. Umesh Ved of M/s Umesh Ved & Associates, Practicing Company Secretary as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting process during the AGM in a fair and transparent manner.

Contact Details: In case of any queries relating to e-voting process, members may refer Frequently Asked Questions (FAQs) and e-voting user manual for members available under the Help Section of www.evoting.nsdl.com. In case of any grievances connected with the facility for voting by electronic means may be addressed to Ms. Pallavi Matre Sr. Manager, National Securities Depository Limited ("NSDL"), TradeWorld, 'A'Wing, 4th Floor, Kamala Mills Compound, Senapati Bapat Marg, Lower Parel, MUMBAI - 400 013, or send an email to evoting@nsdl.co.in or call on 022-24994545 or contact M/s. MCS Share Transfer Agent Limited at mcsstaahmd@gmail.com, Tel: 079-26580461/62/63.

Voting Results: The Voting Results on the resolution passed shall be declared within forty-eight hours of the conclusion of the AGM.

Date: A	ugust 10, 2022
Place: A	hmedabad

For, Nila Spaces Limited By Order of Board of Directors Gopi Dave-Company Secretary



Known As "Devnandan Megamall" O

"Javshree Swaminarayan (Devnandan)

1.00 PM

DEV INFORMATION TECHNOLOGY LIMITED

CIN: L30000GJ1997PLC033479

Thakar, Mr. Bhupatbhai K

Thakar, Mrs. Hansaben

Date

01-06-2021

1

Registered Office : 14, Aaryans Corporate Park, Nr.Shilaj Railway Crossing, Thaltej, Ahmedabad, Gujarat-380059 Email : cs@devitpl.com Website : https://www.devitpl.com Phone : +91-9429899852 / 53

DEV EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR IT Simplified ...

THE QUARTER ENDED JUNE 2022 (Rs. in Lakhs, except per share data)

		Standalone				Consolidated				
Sr. No	Particulars	Quarter ended on 30/06/2022 (Unaudited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 30/06/2021 (Unaudited)	Year ended on 31/03/2022 (Audited)	Quarter ended on 30/06/2022 (Unaudited)	Quarter ended on 31/03/2022 (Audited)	Quarter ended on 30/06/2021 (Unaudited)	Year ended on 31/03/2022 (Audited)	
1	Total Income from operations	2,637.43	3,208.90	2,277.48	10,005.83	2,694.07	3,190.42	2,320.47	10,091.29	
2	Net Profit for the period (before tax,									
	exceptional and /or extraordinary items)	145.48	123.40	54.16	382.79	173.83	96.30	86.99	315.08	
3	Net Profit for the period before tax (after									
	exceptional and /or extraordinary items)#	145.48	123.40	54.16	382.79	173.83	66.67	57.37	196.58	
4	Net Profit for the period after tax (after								(=	
_	exceptional and /or extraordinary items)	147.81	75.58	23.75	191.51	168.96	15.75	6.45	(7.09)	
5	Total Comprehensive income for the period [comprising Profit for the period (after tax) and Other Comprehensive									
	income (after tax)]	146.88	74.64	22.82	187.79	160.78	19.95	11.97	9.68	
6	Paid-up Equity Share Capital (face value of Rs.10/- each)	1,104.10	1,104.10	552.05	1,104.10	1,104.10	1,104.10	552.05	1,104.10	
7 8	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year Earnings Per Share (face value of	-	-	-	2292.35	-	_	_	2,174.51	
-	Rs. 10/- each) (for continuing and discontinued operations)				4 70	4.50			(0.00)	
	1) Basic	1.34	0.68	0.22	1.73	1.53	0.14	0.06	(0.06)	
	2) Diluted	1.34	0.68	0.22	1.73	1.53	0.14	0.06	(0.06)	

Notes :

(1) The above is an extract of the detailed format of Quarter ended Financial Results filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarter ended Financial Results are available on the websites of the National Stock Exchange of India at www.nseindia.com and on the website of the Company at the www.devitpl.com

(2) The above financial results have been reviewed and recommended by the Audit Committee and have been approved and taken on record by the Board of Directors at its meeting held on August. 09. 2022.

(3) The Limited Review as required under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015 has been completed by the auditors of the Company.
 (4) The financial results for the Quarter ended June 30, 2022 have been prepared in accordance with the Companies (Indian Accounting Standards) Rules

2015 (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent applicable

of

	For and on behalf of Board of Directors
	Dev Information Technology Limited
Date : 09/08/2022	sd/- Jaimin J. Shah
Place : Ahmedabad	Managing Director - DIN : 00021880

ચરોતર-અર્થકારણ

'હર ઘર તિરંગા'ની રાષ્ટ્રભાવનાની જયોત સાથે જુલુસને પ્રસ્થાન કરાવાયું ઃ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાયો

આણંદમાં મહોર્રમ પર્વે તાજીયા ઠંડા કરાયા

પેટલાદ, ખંભાત, ઉમરેઠ સહિત ૬૩ ગામોમાં તાજીયા જુલુસ નીકળ્યા : ગોયા તળાવ ખાતે તાજીયાનું વિસર્જન



ચરોતર પંથકમાં પશુઓનો ત્રાસ ચથાવત આશંદમાં ગાયની અડફેટે આવતાં દસ વ્યક્તિને ઇજા : લોકોમાં ભય



વાતાવરણ સજૉવા પામી રહ્યું હોવા છતાં તાજેતરમાં હાઇકોટૅ દ્વારા પણ આ મુદ્દે લાલઆંખ કરવા છતાં તેને આર્શદ પાલિકા ધોળી પી જતી હોય નધરોળ પાલિકા તંત્ર ના પાપે શહેરના સલાટીયા વિસ્તારમાં મહિલા સહિત દશ વ્યક્તિને ગાયે ભેખડે ચઢાવી ઇજાગ્રસ્ત કયૉનો ચઢાવતા ઇજાગ્રસ્ત થયાનો બનાવ રોષની લાગણી વ્યક્ત કરવામાં બનવા પામ્યા નુ જાણવા મળેલ આવી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે છે. પ્રાપ્ત વિગત અનુસાર આણંદ પાલિકા શાસકોની રાજકીય મતોની શહેર વિસ્તારમાં ઠેરઠેર રખડતા મથરાવટીને કારણે ઢોર પકડવાની ઢોર માગૅ ની વચ્ચે અડીગા કામગીરીમાં ઠાગાઠૈયા કરવામાં જમાવતા વાહનચાલકો માં ભયનુ આવી રહ્યા નું જાણવા મળેલ છે.

આશંદ, તા.૯ હાઇકોટૅ દારા શહેર વિસ્તારમાં રખડતા ઢોર મુદ્દે કડક વલણ અપનાવવા ના આદેશ છતાં તેને ધોળી પી જતા હોય તેમ આણંદ પાલિકા ના રખડતા ઢોર પકડવા મુદ્દે નમાલા બનતાં તેના પાપે શંહેરના સલાટીયા વિસ્તારમાં

ટનનુ વજન ધરાવતા જરી મુબારક મહિલા સહિત દશને ગાયે ભેખડે બનાવ બનતા સ્થાનિક વિસ્તારમાં

છેલ્લા નવ દિવસથી વેટરનરી ૧૬૦૦ ડોક્ટરો આંદોલન ચલાવે છે

હુસેન ના નારા સાથે મુખ્યમાગે થંઇ ગોયાતળાવ ખાતે તાંજીયા નુ ઠંડા કરવામાં આવ્યા હતા. આણંદ સહિત જીલ્લાના પેટલાદ, ખંભાત, બોરસદ, ઉમરેઠ સાથે ૬ ૩ ગામમાં બસો ઉપરાંત તાજીયા ને જુલુસ યોજી ઠંડા કરવામાં આવ્યા હતા. આજે તાજીયા જુલુસ દરમ્યાન ખંભાત ખાતે ઇ.સ.૧૭૯૩માં નવાબ પરિવાર દ્વારા ઇરાનથી ૧૧ સુખડના તાજીયા જુલુસ દરમ્યાન આકર્ષેણરૂપ બન્યા હતા. મહોરમ પવૅ ના તાજીયા જુલુસ ના પગલે પોલીસ તંત્ર દ્વારા આણંદ સહિત જીલ્લાભરમા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્રેતાચુગથી રાજસ્વ સાથે આદિવાસી સંસ્કૃતિ જોડાચેલીઃમહેશ વસાવા

જુલુસ ને લીલીઝંડી આપી પ્રસ્થાન

કરાવવામાં આવ્યું હતું. જે યા



આદિવાસી દિન નિમિત્તે આણંદમાં

આદિવાસીઓ દ્વારા રેલી યોજાઇ

આવ્યા બાદ બપોરની નમાઝ ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીપીન પછી ગુજરાતી ચોક ખાતે એક વકીલ દ્વારા કરબલાના શહીદોની થઇ નાયબ પોલીસ અધીક્ષક યાદમાં અને વડાપ્રધાન મોદીના જાડેજા, ભાજપ પ્રેરિત ઓલ હર ધર તિરંગા ની રાષ્ટ્રભાવના ઇન્ડિયા વર્કસૅ એમ્પોઇઝ સંગઠન 🛛 ની જયોત પ્રજવલિત સાથે તાજીયા

સત્ય ના કાજે પોતાના ૭૨ જેટલા આવતું હોય આજે અનુરાધા

શહાદતના પગલે મંગળવારે આણંદના ગુજરાતી ચોકથી કરબલાના શહીદોની યાદમાં અને આઝાદીના અમૃત મહોત્સવ ના હર ધર તિરંગા ની રાષ્ટ્રભાવના સાથે તાજીયા જુલુસ નિકળ્યું હતું. આશંદ સહિત જીલ્લાના પેટલાદ, ખંભાત, બોરસદ, ઉમરેઠ મળી ૬૩ ગામોમાં તાજીયા જુલુસ નિકળ્યા હતા. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સાથીઓ સાથે શહીદી વહોરી મહોરમ કમીટી, ઇસ્માઇલ નગર, પ્રાપ્ત વિગત અનુસાર આશરે ચૌદ હતી. તેમની યાદમાં પ્રતીવર્ષ મેમણ કોલોની, જુના દાદર સૈકા પૂર્વ ઇસ્લામ ધર્મ ના હજરત મહોરમ પવૅ પર મુસ્લિમ સમાજ સહિતના વિવિધ વિસ્તારમાં ૩૭ પયગંબર ના દોહિત્ર હજરત હુસેને દ્વારા યાવમે આશુરા મનાવવામાં જેટલા તાજીયા સ્થાપિત કરવામાં

આણંદ, તા.૯ આશરે ચૌદ સૈકા પૂર્વ ઇસ્લામ

ધર્મ ના હજરત પંચગંબરના

દોહિત્ર હજરત હુસેને તેમના ૭૨

સાથીઓ સાથે સત્ય માટે વહોરેલી

આણંદનીવેટરનરીકોલેજના તબીબો આમરણાંત ઉપવાસ પર ભચ્ચા સહિતની વિવિધ માંગણી ન સંતોષાતાં ડોક્ટરો આક્રમક મૂડમાં



જ્યાં પશુપાલન અને ડેરી ઉદ્યોગ કોલેજો રાજસ્થાન, પંજાબ અને સુવિકસિત છે ત્યાં પશુચિકિત્સકોનાં બિહારનાં પશુચિકિત્સકો પણ હવે ઈન્ટર્નશિપ વધારાની માંગ ્ગુજરાતની આ હડતાળને સમર્થન વખતોવખત ઉઠી રહી છે. આ માંગ આપી રહ્યાં છે. આણંદ વેટરનરી ન સંતોષાતા હવે ગુજરાત રાજ્યની કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા સરકાર કામધેનુ યુનિવર્સિટીની ચારેય સુધી પોતાની માંગ પહોંચાડવા વેટરનરી કોલેંજનાં ૧૬૦૦ થી પણ ઍનેક પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં. વધુવિદ્યાર્થીઓ છેલ્લાં આઠ દિવસથી શરૂઆતનાં દિવસોમાં કલેક્ટરશ્રી અનિશ્ચિતકાલિન હડતાળ પર ઉતરી દ્વારા આવેદનપત્રો મોકલવામાં ગયેલ છે. આ સાથે જ આણંદમાં પણ આવ્યાં હતાં. સરકારે કોઈ પ્રતિભાવ ન આપતાં આંદોલનએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અનેક વખત રેલી, ધરણાં પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરવામાં સ્ટાઈપેન્ડ જે અન્ય રાજ્યો જેવા ચિન્હ ધરાવતી સરકાર દ્વારા ઉકેલ આવ્યાં હતાં છતાં નકકર પરિણામ ન આવતાં આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ં ઉગામવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.

આશંદ, તા.૯

છેલ્લા નવ દિવસથી વેટરનરી ના ૧૬૦૦ થી વધુ તબીબો દ્વારા અનિશ્ચિતકાલીન હડતાલ કરવામાં આવી રહી છે છતાં સરકાર દારા કોઈપણ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી આથી અંતે તબીબો આમરણાંત ઉપવાસના શરણે ગયા હતા. મંગળવારે ઓગષ્ટ ક્રાન્તિદિને વેટનરી કોલેજ આણંદના ચાર વિદ્યાર્થીઓ આમરણાંત ઉપવાસ ઉપર ઉતરી જ્યાં સુધી સરકાર દ્વારા માંગણી નઈ સ્વીકારાય ત્યાં સુધી ઉપવાસ ઉપરથી ઊભા નહીં થાય. શું સરકાર પશુચિકિત્સકો માટે સંવેદનશીલ છે કે કેમ?ના સવાલ ઉઠવા પામ્યા છે.

વેટરનરી ઈન્ટર્નશિપ ભથ્થુ જે હાલ રૂ. ૪૨૦૦ મળે છે, વધારીને ૧૮૦૦૦ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્યનાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ છેલ્લાં આઠ દિવસર્થી ૪૦૦ થી વધુ વેટરનરી વિદ્યાર્થીઓ રાજ્યવ્યાપી અનિશ્ચિતકાલિન હડતાળમાં જોડાયેલ છે. વારંવાર હડતાળ પર ઉતરેલાં છે. ઈન્ટર્નશિપ રજૂઆત કરવા છતાં ગાધીજીના ત્રણ કે પંજાબ - ૧૫૦૦૦, બિહાર - લાવવામાં ન આવતા આમરણાંત ૧૫૦૦૦, રાજસ્થાનમાં ૧૪૦૦૦ ઉપવાસ શસ્ત્ર ઉગામવામા આવ્યું આપવામાં આવે છે. ગુજરાતમાં છે.દેશભરની અન્ય વેટરનરી

રજૂઆત કરવામાં આવી હોવા છતાં રલ્વ વિભાગ ની આળસતા હોવાનુ જણાવ્યું હતું. ત્યારે આશ્વર્ય એછેકે રેલ્વે પોલીસના ઉચ્ચ અધીકારી સ્થાનિક ને સાસદને રજૂઆત કરવા સુચન કરે ત્યારે ઉચ્ચ એધિકારી ની બોલિશતા કેમ?જેવા સવાલ ઉઠવા પામી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છેકે તાજેતરમાં આણંદ સાસદ દ્વારા રેલ્વે સ્ટેશન ના બ્યુટીફિકેશન કરવા કેન્દ્ર રેલ્વે વિભાગમાં રજૂઆત છે.ગતરોજના આણંદ રેલ્વે સ્ટેશન કરી છે. પરંતુ રેલ્વે પોલીસ સ્ટેશન ખાતે સરકારના ઇ એફઆઇઆર એપ નું રેલ્વે ડીઆઇજી તથા પોલીસ નવીનીકરણ હોય કે છેલ્લા બે વર્ષ થી પ્લેટફોર્મ આવાગમન માટે બનતો વડા દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યા ફટબ્રીજની મંથરગતી મુદ્દે સાસદ બાદ અંગ્રેજ ના શાસન દરમ્યાન સ્ટેશન સાકાર થયાબાદ હાલમાં આઠદાયકા પૂર્વે સાકાર રેલ્વે પોલીસ સંહિત સ્થાનિક રેલ્વે સમીતીના સ્ટેશન ખખડેંધજ બની રહેતા તેના સભ્યો નિષ્ફળ બની રહ્યા હોય નવીનીકરણ કયારે ના સવાલ પર રેલ્વે પોલીસના અધિકારીઓ દારા રેલતંત્રની આડોડાઇ કેમ જેવા રેલતત્ર પર જવાબદારી ઢોળવાનો વડોદરા ડીઆરએમ આડોડાઇ કરતાં સવાલ સાથે સાંસદ સહિત સ્થાનિક પ્રયાસ કરતાં આ મુદ્દે તપાસ હાથ હોય ઉચ્ચક્ષાએ રજૂઆત પાછળ રેલસમીતી સભ્યો ની શુષ્કતા પણ ધરતા સ્થાનિક રેલ્વે પોલીસ દ્વારા પાછીપાની કેમ તેવાં સવાલ ઉઠી દાખવા પામી રહ્યા નું જાણવા મળેલ વર્ષ ૨૦૦૩થી નવીનીકરણ માટે રહ્યા છે.

આદીવાસી સંસ્કૃતિ સ્થપાયેલ હોય આજે વિશ્વ

ભવ્ય આદિવાસી રેલી યોજાઇ હતી. આ પ્રસંગે આદિવાસી નેતા અને પાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ ત્રેતાયુગ થી આદિવાસી સંસ્કૃતિ રાજસ્વ સાથે જોડાયેલ છે. જે (વકીલ), વાઈસ પ્રેસિડેન્ટ અને વતૅમાનમા પણ સંકળાયેલી હોવાનું જણાવ્યું હતું. આદીકાળથી આદિવાસી

આણંદ, તા.૯

સીઇઓ ડૉ. પાર્થ બી. પટેલ, સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ. ઈશિતાબેન સંસ્કૃતિ હોવા સાથે ત્રેતાયુગ માં નાપ્રસ્થાનપૂર્વબીરલામુંડાની તસ્વીર પટેલ, વગેરે ઉંપસ્થિત રહ્યા હતા. ભગવાન રામના વનવાસ દરમ્યાન સાથે શસ્ત્ર પૂજન આવ્યું હતું.

અર્થે સરદાર પટેલ એ ૧૯૪૭માં પદ્દ ર રજવાડાઓનું એકત્રીકરણ કર્યું અને આજે ૭૫ વર્ષની આઝાદીનોં રાષ્ટ્રધ્વજ અર્પણ કરવાનો કાર્યક્રમ ઉજવણી અમૃત મહોત્સવ હેઠળ કરી યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના વંદે ભારત દેશના યુવા સાથે તમામ પ્રમુખ અને ભાજપ પ્રેરિત ભારતીય નાગરિકોમાં રાષ્ટ્રભાવના ચેતનવંતી કામગાર કર્મચારી સંગઠન ના કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બીપીન વકીલે વંદે હર ઘર તિરંગાનો સંકલ્પ કરી આ માતરમ સહ જણાવ્યું કે કાશ્મીરથી ૧૫મી ઓગસ્ટના સ્વાતંત્રતા પર્વને

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ કાર્ચક્રમનું આચોજન

આણંદમાં એપીએમએસ સંસ્થા દ્વારા

વિદ્યાર્થીઓ અને સ્ટાફને તિરંગાનું વિતરણ

ઉજવણી અંતર્ગત આઝાદી કા અમ્ ત મહોત્સવ હેઠળ દેશનું ગૌરવ અને સાર્વભૌમત્વનું પ્રતીક રાષ્ટ્રધ્વજ તિરંગાના અભિવાદનમાં સમગ્ર દેશમાં ૧૩ થી ૧૫ ઓગષ્ટ 'હર ઘર તિરંગા' કાર્યક્રમ યોજવાનું નક્કી થયું હોઈ વધુમાં વધુ ઘર પર તિરંગો લહેરાય એવી રાષ્ટ્રં ભાવના સાથે આંશદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા અહીં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફગણને કન્યાકુમારી અખંડ ભારતના નિર્માણ ભવ્ય બનાવ્યો છે. તેઓએ આજના

<u>આણંદ, તા.૯</u> દેશની આઝાદીના ૭૫ વર્ષની

ભારત ચીનને મોટો ઝટકો આપી શકે છે ભારતમાં ૧૨ હજારથી ઓછી કિંમતના ચીની ફોન પર પ્રતિબંધ લગાવાશે

કંપનીઓએ આ શિપમેન્ટમાં ૮૦ ટકાનું યોગદાન આપ્યું. ભારત સરકારે પહેલા જ દેશમાં કામ



નવીદિલ્હી,તા.૦૯

આદિવાસી ગુહરાજાએ રાજસ્વ સાથે સંસ્કૃતિ ને જોડી હતી. જે સંસ્કૃતિ આજે પણ યથાવત રહેવા પામી હોય નુ આજે વિશ્વ આદિવાસી દિને આદિવાસી નેતા અને પાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાના નેતૃત્વમાં યોજાયેલ પારંપારિક સંસ્કૃતિ ને ઉજાગર કરતી ભવ્ય રેલી દરમ્યાન વસાવાએ જણાવ્યું હતું. રેલી દરમ્યાન વિવિધ સંસ્કૃ તિ વસ્ત્રો પરીધાન તથા તીરકામઠા સાથે આદિવાસી નૃત્યની ઝાખી ઉભી કરવામાં આવી હતી. સવારના રેલી

આદિવાસી દિને આણંદ ખાતે પારંપારિક સંસ્કૃતિ સાથે આદિવાસી

ફૂટઓવર બ્રિજની કામગીરી પણ ખૂબ જ ધીમી ગતિએ ચાલે છે ખખડધજ આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનને અત્યાધુનિક કરવામાં રેલવેની આડોડાઇ

આદીકાળથી પ્રસંગે રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' ના રચયતા મહાકવિ રવીન્દ્રનાથ ટાગોરને પણ યાદ કરી જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ કાયમ આપશા દિલમાં ફરકતો રહેવો જોઈએ. સંસ્થાના પ્રમુખ બિપીનચંદ્ર પી. પટેલ

કરા રહેલા ચાના ફમાં, જેમ કે શાઓમી, ઓપ્પો અને વીવો પર મની લોન્ડ્રિંગના આરોપ લાગ્યા છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર આ પગેલાથી એપ્પલ ઇંક કે સેમસંગ

ઇલેક્ટ્રિક્સ કંપનીએ પ્રભાવિત ન

થવું જોઈએ, જે તેના ફોનની કિંમત

સવાલનો જવાબ આપ્યો નહીં.

લાવા અને માઇક્રોમેક્સ જેવી ઘરેલૂ

કંપનીઓએ ભારતના સ્માર્ટફોનના

વેચાણમાં અડધાથી ઓછી ભાગીદારી

સામેલ કરી છે. ચીની સ્માર્ટફોન

ખેલાડી હવે ભારતમાં મોટા

ઈન્ડિયા ચીની સ્માર્ટફોન નિર્માતાઓને ૧૨,૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતની ડિવાઇસ વેચવા વધુ છે. ઠૈર્ટઢે, ઇીટક્રક્રદી દિહજર્જેહના પર પ્રતિબંધ લગાવી શકે છે, જેથી પ્રતિનિધિઓએ કોમેન્ટ્સનો જવાબ શાઓમી કોર્પ સહિત ઘણી બ્રાન્ડને ન આવ્યો. જાણવા મળી રહ્યું છે કે ઝટકો લાગશે. ભારતીય બજારમાંથી ભારતના ટેકનોલોજી મંત્રાલયના બહિષ્કારથી શાઓમી અને તેના પ્રવક્તાઓએ પણ બ્લૂમબર્ગ ન્યૂઝના દેશની ઘણી કંપનીઓએ નુકસાન ઉઠાવવું પડશે. જેણે હાલના વર્ષોમાં ભારતમાં મોટું રોકાણ કર્યું, જ્યારે ઘરેલૂ બજાર કોવિડ-૧૯ લૉકડાઉનને કારણે ખતમ થવા પર છે. ૧૫૦ ડોલરથી ઓછી કિંમતના સ્માર્ટફોને જૂન ૨૦૨૨ એક ક્વાર્ટર માટે ભાગનો સામાન વેચે છે, પરંતુ તેનું ભારતના વેચાણની માત્રામાં એક બજાર પ્રભુત્વ સ્વતંત્ર અને નિષ્પક્ષ તૃતિયાંશ યોગદાન આપ્યું, ચીની હરિફાઈનાં આધાર પર નથી.



SAMBHAAV MEDIA LIMITED (CIN: L67120GJ1990PLC014094)

Registered Office: "Sambhaav House", Opp. Judges' Bungalows, Premchandnagar Road, Satellite, Ahmedabad - 380 015 Phone: +91 79 2687 3914/15/16/17 Fax: +91 79 2687 3922 Email: secretarial@sambhaav.com Website: www.sambhaav.com EXTRACTS OF STANDALONE AND CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED ON JUNE 30, 2022

આણંદ, તા.૯

સમીતી સભ્યો શુષ્ક, આઠદાયકા

પૂવૅ અંગ્રેજ શાસન દરમ્યાન આણંદ

રેલ્વે સ્ટેશન હદમાં રાજ્ય પોલીસ

ખખડધજ બનતાં અત્યાધુનિક

બનાવવા વારંવાર માગ કરવા છતાં

સાંસદ સહિત સ્થાનિક રેલ

	(₹ in Lakhs)								
			Stand	alone		Consolidated			
			Quarter Ended		Year Ended	Quarter Ended			Year Ended
SN	Particulars	30-06-22	30-06-21	31-03-22	31-03-22	30-06-22	30-06-21	31-03-22	31 -03-22
	(Refer Notes below)	Unaudited	Unaudited	Audited	Audited	Unaudited	Unaudited	Audited	Audited
1	Total Income from Operations	980.35	1,007.24	1,387.05	4,468.38	980.35	1,007.24	1,411.05	4,501.43
2	Net Profit! (Loss) for the period (before Tax, Exceptional items	(4.44)	10.54	(36.50)	7.37	(9.41)	2.63	3.30	19.79
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)	(4.44)	10.54	(36.50)	7.37	(6.55)	14.38	(8.70)	25.64
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	(5.77)	9.31	(23.91)	(17.40)	(7.98)	13.15	4.39	1.37
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	(5.97)	9.98	(26.23)	(15.53)	(8.18)	13.82	1.32	2.49
6	"Equity Share Capital (Face Value of ₹1/- per share)"	1,911.11	1,911.11	1,911.11	1,9 1 1.11	1,911.11	1,911.11	1,911.11	1,911.11
7	Other Equity (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet)	-		•	6,450.55			•	6,609.66
8	Earning per share of $\ensuremath{\overline{\tau}}$ 1/- each (from Continuing and Discontinuing Operations)					•			
	Basic (in ₹)	(0.00)	0.01	(0.01)	(0.01)	(0.00)	0.01	0.00	0.00
	Diluted (in ₹)	(0.00)	0.01	(0.01)	(0.01)	(0.00)	0.01	0.00	0.00
1.	1. The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings								

The above is an extract of the detailed format of Quarterly Financial Results reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on Augsut 9, 2022 and the same is filed with the BSE Limited and National Stock Exchange of India Limited under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of Quarterly Financial Results and Notes thereto are available on the website of the Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.sambhaav.com

Place : Ahmedabad Date : August 09, 2022

For and on behalf of the Board of Directors Kiran B Vadodaria Chairman & Managing Director DIN: 00092067

LOKSAT

નીલા સ્પેસીસ લિમીટેડ

(CIN No: L45100GJ2000PLC083204) રજીસ્ટર્ડ ઓફિસઃ પહેલો માળ, સમભાવ હાઉસ, ચીફ જસ્ટિસ બંગલો સામે, બોડકદેવ, અમદાવાદ - ૩૮૦ ૦૧૫. **કોનઃ** +૯૧ ૭૯ ૪૦૦૩ ૬૮૧૭/ ૧૮ **ફેક્સઃ** +૯૧-૭૯-૨૬૮૭૩૯૨૨ E-mail: secretarial@nilaspaces.com Website: www.nilaspaces.com

22મી વાર્ષિક સામાન્ય સભાની નોટિસ, રિમોટ ઈ-વોટીંગ માહિતી તથા બૂક ક્લોઝર

આથી નોટિસ આપવામાં આવે છે કે કંપનીની 22મી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) બુધવાર, તા. 31 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 04:00 કલાકે વીડિઓ કોન્ફરન્સ (વીસી) અથવા અન્ય ઓડીઓ વીડિઓ માંઘ્યમ (ઓએવીમ) દ્વારા યોજાશે. જેમાં એજીએમની તા. 18 મે, 2022ની નોટિસમાં દર્શાવ્યા અનુસારના કામકાજ હાથ દરવામાં આવશે. આથી જણાવામાં આવે છે કે એજીએમ કોઈ એક સ્થળ પર સભ્યો ની વ્યક્તિગત રૂપે હાજરી વગર યોજાશે. સભ્યો ફક્ત વીસી/ ઓએવીમ દ્વારા હાજર રહી શકે છે અને ભાગ લઇ શકે છે.

ડિસ્પેચ: મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના, પરિપત્ર નં.૧૪/૨૦૨૦ તા.૮મી એપ્રિલ,૨૦૨૦, પરિપત્ર નં ૧७/૨૦૨૦ તા.૧૩મી એપ્રિલ, ૨૦૨૦ અને પરિપત્ર નં ૨૦/૨૦૨૦ તા. ૫મી મે, ૨૦૨૦, પરિપત્ર નં ૩૯/૨૦૨૦ તા. ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૦ તથા પરિપત્ર નં ૦૨/૨૦૨૧ તા. ૧૩મી જાન્યુઆરી, ૨૦૨૧ (સમસ્ત મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સના પરિપત્રો) તથા સિક્યોરિટીઝ એન્ડ ਲੇਡਬੇਕੇਕ ਅੰਤ ਅੰਡ ਬੱਕਿੰਬੰਗ ਪਟਿਪੁਕ ਰ. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 ਰੀ. 92ਮੀ ਮੈ. 2020 ਰਥਾ ਪਟਿਪੁਕ નં. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 તા. 15મી બાન્યુઆરી , 2021 અને 5 મે 2022ની સ્પષ્ટતા (સમસ્ત સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પરિપત્રો) ને ધ્યાન રાખતા , કંપનીની એજીએમની નોટિસ અને નાણાકીય વર્ષ 2021-22 નો વાર્ષિક અદેવાલ તથા ઇવોટિગની સુચના એવા તમામ શેરહોલ્ડરો કે જેમના ઇમેલ કંપની અથવા ડિપોઝીટરી પાસે નોંધાચાલા હોચ તેમને ઇમેલ દ્વારા મંગળવારે, તા. 09 ઓગસ્ટ, 2022ના રોજ મોકલી આપવામાં આવેલ છે.

સભ્યોએ નોંધ લેવી કે એજીએમની નોટિસ તથા વાર્ષિક અહેવાલ 2021-22 કંપનીની વેબસાઈટ-www.nilaispaces.com તથા સ્ટોક એક્સચેન્જ બીએસઈ લિમીટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમીટેડની વેબસાઈટ www.bseindia.com તથા www.nseindia.com,પર ઉપલબ્ધ છે તથા ઈ-વોટિંગની સુવિધા પૂરી પાડનાર સંસ્થા નેશનલ સીક્યુરીટીઝ ડીપોઝીટરી લિમિટેડ (NSDL) વેબસાઈટઃ www.evoting.nsdl.com પર પણ ઉપલબ્ધ છે.

બુક કલોઝરઃ કંપની અધિનિયમ,૨૦૧૩ની કલમ ૯૧ અને તે હેઠળ ઘડવામાં આવેલ નિયમો તેમજ ૨ેગ્યુલેશન ૪૨ ઓફ ସିଚ୍ଚଧାરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (લિસ્ટિંગ ઓળ્લિગેશન્સ એન્ડ ડિસ્ક્લોઝર રિક્વાયર્મેન્ટ્સ) રેગ્યુલેશન્સ ૨૦૧૫ની જોગવાઇ મુજબ, કંપનીના સભ્યોનું રજિસ્ટર અને શેર ટ્રાન્સફરનું રજીસ્ટર **ગુરવાર, તા. 25 ઓગસ્ટ, 2022 થી** બુધવાર તા. 31 ઓગસ્ટ, 2022(બન્ને દિવસો સહિત) એજીએમના હેતુ માટે બંધ રહેશે.

રીમોટ ઇ-વોટીંગઃ આ ઉપરાંત કંપની અધિનિયમની કલમ ૧૦૮ સાથે કંપની (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન રૂલ્સ, ૨૦૧૪ રિક્વાચર્ડમેન્ટ) ના રેગ્યૂલેશન ૪૪ હેઠળ કંપનીના સભાસદો કે જેમના નામ <mark>કટ ઓફ તરીક બુધવાર, તા. 24 ઓગસ્ટ,</mark> 2022ના રોજ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં નોંધાચેલા છે તેમને નોટિસમાં દર્શાવેલ બધા મુદ્દાઓ પર રિમોટ ઇ-વોટિંગ તથા એજીએમ દરમીયાન ઇ-વોટિંગ કરવાની સુવિધા આપવામાં આવેલી છે જે માટે NSDL ની નિમણુંક કરવામાં આવી છે. મતદાન અધિકારો સભ્યો પાસે કટ ઓફ તા. 24 ઓગસ્ટ, 2022ના રોજ ની સ્થિતિ મુજબ રહેલા શેરહોર્હીંગ ની સ્તિતિ પર આધાર રહેશે. ઈ-વોટિંગ નીચે મુજબ ૨૯ેશેઃ

ઈ-વોટિંગ શરૂઆંત થવાની તારીખ અને સમયઃ રવિવાર, તા. 28 ઓગસ્ટ, 2022 સવારે 9:00 કલાકે. ઈ-વોટિંગ પુરું થવાની તારીખ અને સમયઃ મંગળવાર, તા. 30 ઓગસ્ટ, 2022 સાંજે 5:૦૦ કલાકે

ઇવોટિંગ ના. 30 ઓગસ્ટ, 2022 સાંજે પ:૦૦ કલાક બાદ કરી શકાશે નહીં. એક વાર સભ્ય દ્વારા કોઈ એક ઠરાવ ઉપર ટિમોટ ઈ-વોટિંગ દ્વારા મત આપી દીધો હોય તો પાછળ થી પોતાના મત બદલી શકાશે નહીં. એવા તમામ સભ્યો કે જેમણે રિમોટ ઈ-વોટિંગ કરેલ હોચ તેઓ વીસી / ઓએવીમ દ્વારા એજીએમમાં ભાગ લઇ શક્શે,પણ તેમને એજીઅએમમાં ફરી થી મતદાન કરવાની મંજૂરી મળશે નહી. ઇવોટિંગના સમય દરમ્યાન સભ્યો કે જેઓના શેર તા. 24 ઓગસ્ટ, 2022 ના રોજ ફીઝીકલ કે ડીમેટ ફોર્મમાં હોચ તેઓ ઇવોટિંગ કરી શકે છે. જેઓ આ નોટિસ મોકલ્યા પછી શેર લીધા હોચ અને તા. 24 ઓગસ્ટ, 2022ના રોજ સભ્ય હોય તેઓ evoting@nsdl.co.in પર અરજી મોકલીને લોગઇન અને પાસવર્ડ મેળવી શકે છે. અથવા તો કંપનીના ઇમેલ આઇડી secretarial@nilaispaces.com કે કંપનીના શેર રજીસ્ટ્રાર મે. એમ સી એસ શેર ટ્રાન્સફર એજન્ટને mcsstaahmd@ gmail.com ઉપર ઇમેલ લખી શકે છે. જે સભ્યો NSDL સાથે પહેલેથી જ રજિસ્ટર છે તેમના વર્તમાન લોગઇન અને પાસવર્ડનો ઉપયોગ કરી શકે છે.

સ્કુટીનાઇઝર : ઇ-વોટિગના દેતુથી સ્કુટીનાઇઝર તરીકે મે. ઉમેશ વેદ એન્ડ એસોસિચેટસના શ્રી ઉમેશ વેદ (કંપની સેક્રેટરી)ની નિમણુક કરવામાં આવી છે

સંપર્ક: કોઈપણ પ્રશ્ન કે સંદેહ હોય તો એ માટે સભ્યો NSDL ની વેબસાઈટ www.avoting.nsdl.com પર ઉપલબ્ધ હેલ્પ રોક્શનમાં અને સભ્યો માટેના ફિક્વિન્ટલી આસ્કડ ક્વેશ્વનસ (FAQs) જોઈ શકે છે અથવા પલ્લવી મ્હાગ્રે, સીનીયર મેનેજર નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, ટ્રેડવર્લ્ડ, 'એ'વિંગ, ચોથો માળ, કમલા મિલ્સ કમ્પાઉન્ડ, સેનાપતિ બાપટ માર્ગ, લોઅર પરેલ, મુંબઈ - 400 013 અથવા નંબર: 022-24994545 અથવા NSDL હેલ્પડેસ્ક ના ઇમેલ પર ઇમેલ મોકલી evoting@nsdl co.in અથવા મે. એમ સી એસ શેર ટ્રાન્સફર એજન્ટ લિમિટેડના ઈમેલ mcsstaahmd@gmail.com અથવા ટેલી. નંબર 079 2658 0461/62/63 ਪੁਣ સંਪੁર્ક કરી શકે છે.

મતદાન પરિણામ : પાસ થયેલા ઠરાવો પર મતદાન પરિણામ એજીએમની સમાંત્રિના ૪૮ કલાકની અંદર જાહેર કરવામાં આવશે.

	બોડના આદેશથી
તારીખ : ઓગસ્ટ 10, 2022	નીલા સ્પેસીસ લિમીટેડ, વલી
રથળ : અમદાવાદ	ગોપી દવે-કંપની સેક્રેટરી



SAMBHAAV GROUP

ટુ વ્હીલર ચાલકેને માત્ર હેલ્મેંટ પહેરવાનો કાયદો નથી. હેલ્મેટ સાથે જોડાયેલા કેટલાક નિયમ પણ લાગૂ થાય છે. જો તમે તેને ફોલો નહી કરો તો ટ્રાફિક પોલીસ દંડ કરી શકે છે. ટુ વ્હીલર ચાલકનું હેલ્મેટ કેવુ દેખાવવું, કઈ રીતે બનેલુ હોવુ જોઈએ, સરકારે કેટલાંક નિયમ નક્કી કર્યા છે. ટુ વ્હીલર ચલાવતા સમયે હેંલ્મેટ પહેરવુ તે ખૂબ જરૂરી છે. હેલ્મેટથી ટું વ્હીલર ચાલક સુરક્ષિત રહી શકે છે. જોકે કેટલિક વખતે ટ્રાફિક પોલીસના દંડથી પણ બચી શકાય છે. મોટા ભાગના કેસમાં હેલ્મેટ પહેરીને નિકળતા ચાલકને ટ્રાફિક પોલીસકર્મીઓ રોકતા નથી.